



# The Baroda Rayon Corporation Ltd.

CIN L45100GJ1958PLC000892

P O Fatehnagar, Udhna, Surat 394 220

Tel : 0261-2899555

Email : admin@brcl.in, brcsurat@gmail.com

Website : www.brcl.in

10<sup>th</sup> November, 2023

To,  
Department of Corporate Services,  
BSE Limited  
P. J. Towers, Dalal Street,  
Mumbai – 400 001.

**Sub – Newspaper Advertisement – Publication of Financial Results of the company for  
the quarter and half year ended 30<sup>th</sup> September, 2023.**

**Ref – BSE Scrip code – 500270**

Dear Sir,

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of the financial results of the company for the quarter and half year ended 30<sup>th</sup> September, 2023 published in Financial Express (English) and Pratap Darpan (Gujarati) newspapers.

Request you to kindly take the same on your record.

Thanking you,

Yours faithfully,

**For The Baroda Rayon Corporation Limited**

*Kunjai S Desai*

**Kunjai Desai  
Company Secretary**



Encl: As Above

## THE BARODA RAYON CORPORATION LIMITED

Reg. Office: P.O. Baroda Rayon, Fatehnagar, Udhna, Dist. Surat-394220 | (T) 0261-2899555  
 Email-admin@brcl.in, brsarat@gmail.com | Website-www.brcl.in | CIN - L45100GJ1958PLC000892

## Extract of Standalone Un-audited Financial Results for the Quarter &amp; half year ended 30th September, 2023 (Rs. in lakhs)

Sr. No.	Particulars	Quarter ended		Year ended	
		30.09.2023 (Un-audited)	30.09.2023 (Un-audited)	30.09.2022 (Un-audited)	31.03.2023 (Audited)
1	Total Income from operations (net)	641.20	6066.95	-	5844.00
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	228.66	1001.43	399.26	25599.35
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	1006.16	1822.91	399.26	27274.34
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	1006.16	1822.91	399.26	27274.34
5	Total Comprehensive Income for the period (comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	1006.16	1822.91	399.26	27274.34
6	Equity Share Capital	2291.14	2291.14	2291.14	2291.14
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of the previous year	-	-	-	27882.21
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	4.39	7.96	1.74	119.84
	Basic:	4.39	7.96	1.74	119.84
	Diluted:	4.39	7.96	1.74	119.84

Note:  
 The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full formats of the Quarterly Financial Results are available on the Bombay Stock Exchange website (www.bseindia.com) and company's website (www.brcl.in).

For The Baroda Rayon Corporation Limited  
 Sd/-  
 Damodarbhai Patel  
 Managing Director | DIN-00056513

Date : 08-11-2023  
 Place : Surat.

## THE SANDESH LIMITED

REGD. OFFICE : "SANDESH BHAVAN", LAD SOCIETY ROAD, B/H. VASTRAPUR GAM, RO. BODAKDEV, AHMEDABAD - 380 054.(GUJ.) | (CIN - L22121GJ1943PLC000183)

સંદેશ

## EXTRACT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2023 (Rs. in lacs, except per share data)

SR. NO.	PARTICULARS	STANDALONE						CONSOLIDATED					
		QUARTER ENDED			HALF YEAR ENDED			QUARTER ENDED			HALF YEAR ENDED		
		September 30, 2023	June 30, 2023	September 30, 2022	September 30, 2023	September 30, 2022	March 31, 2023	September 30, 2023	June 30, 2023	September 30, 2022	September 30, 2023	September 30, 2022	March 31, 2023
		UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED
1	Total Income from Operations	7199.62	7198.71	8109.41	14398.33	16311.01	33921.72	7245.73	7243.08	8151.23	14488.81	16380.31	34075.94
2	Net Profit for the period before Tax, Exceptional items	3387.46	4353.46	5586.54	7740.92	7363.40	13215.91	3384.93	4346.63	5583.28	7731.56	7333.75	13158.13
3	Net Profit for the period before Tax after Exceptional items	3385.92	4367.33	5610.06	7753.25	7562.57	13411.67	3383.39	4360.50	5606.80	7743.89	7532.92	13353.89
4	Net Profit for the period after tax & Exceptional items	2594.34	3312.97	4409.05	5907.31	5758.21	10201.94	2591.33	3306.60	4405.35	5897.93	5728.02	10141.34
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax))	2594.34	3312.97	4409.05	5907.31	5758.21	10865.00	2591.33	3306.60	4405.35	5897.93	5728.02	10805.31
6	Paid-up Equity Share Capital	756.94	756.94	756.94	756.94	756.94	756.94	756.94	756.94	756.94	756.94	756.94	756.94
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance sheet of previous financial year)	-	-	-	-	-	104356.66	-	-	-	-	-	104744.74
8	Earnings Per Share (of Rs. 10/- each) (Not Annualised)	34.27	43.77	58.25	78.04	76.07	134.78	34.23	43.68	58.20	77.92	75.67	133.98
	Basic:	34.27	43.77	58.25	78.04	76.07	134.78	34.23	43.68	58.20	77.92	75.67	133.98
	Diluted:	34.27	43.77	58.25	78.04	76.07	134.78	34.23	43.68	58.20	77.92	75.67	133.98

## Notes:

- The above is an extract of the detailed format of Standalone and Consolidated Unaudited Financial Results for the Quarter and Half Year ended September 30, 2023, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the aforesaid Financial Results are available on the Stock Exchanges' websites (www.bseindia.com & www.nseindia.com) and Company's website (www.sandesh.com).
- The aforesaid Financial Results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of the Directors at their meeting held on November 08, 2023. The same have also been subject to Limited Review by the Statutory Auditors. There are no qualifications in the report issued by the Auditors.
- In accordance with Ind AS 108, Operating Segments, the company has disclosed the segment information in the consolidated financial statements.
- Figures for the previous periods have been regrouped / re-arranged, wherever considered necessary.

For and on behalf of the Board  
 The Sandesh Limited

SANDESH  
 GROUP  
 Meta | Real Estate | Chemicals

Place : Ahmedabad  
 Date : November 08, 2023

Parthiv F. Patel  
 (DIN: 00050211)  
 Managing Director

CONTACT NO. (079) 4000 4000, 4000 4279 • EMAIL: CS@SANDESH.COM • WEBSITE: WWW.SANDESH.COM

## PSL Limited in Liquidation

## SALE NOTICE

Liquidator: Mr. Nitin Jain

Email- assetsale1@aaainsolvency.in, assetsale2@aaainsolvency.in, psl.limited@aaainsolvency.com, nitinjain@icchinencapitalservices.com Mob.- 8800865284 (Mr. Puneet Sachdeva, Mr. Wasim and Mr. Rajkumar)

## E-Auction

Sale of Assets under Insolvency and Bankruptcy Code, 2016  
 Date and Time of E-Auction: December 13, 2023 at 3:00 PM to 5:00 PM  
 Last Date of EMD submission: December 11, 2023 upto 3:00 PM  
 Dates for Submission of Eligibility Documents - By Prospective Bidder :  
 November 09, 2023 till November 22, 2023  
 (With unlimited extension of 5 minutes each)

Sale of Assets owned by PSL Limited (in Liquidation) forming part of Liquidation Estate formed by the Liquidator, appointed by the Hon'ble National Company Law Tribunal, Bench, Ahmedabad vide order dated 11th September, 2020. The sale will be done by the undersigned through the E-Auction platform https://nbsd.nesi.co.in/app/login.

The Delhi High Court vide order dated 01/03/2023 has permitted the Liquidator to sell out the attached asset of PSL Limited. The copy of order shall form part of the E-Auction document.

Particulars of the Asset	Block	Reserve Price (In Rs.)	Initial EMD Amount (In Rs.)	Incremental Value (In Rs.)
<b>Core Assets - Option I / BLOCK A (Asset Sold on Collective basis IBBJ Liquidation Regulation 32(c))</b>				
Pipe Manufacturing Unit at Chengalpattu, TN - Land & Building, Plant & Machinery, Inventory and Consumables	A	67.50 Crores	6.75 Crores	10.00 Lakhs

**Important Notes:**  
 1. The reserve price so arrived is based on valuation reports obtained from two registered valuers, which was duly approved with a majority voting and adopted by the Stakeholder Consultation Committee in the 31<sup>st</sup> SCC Meeting held on October 04, 2023.  
 2. The assets forming part of the Block A i.e. 'Core Assets' will be sold as a set of assets collectively basis as per the relevant provisions of Insolvency & Bankruptcy Code 2016 and IBBJ (Liquidation Process) Regulation 2016, and the terms and conditions pertaining aforesaid Blocks of asset shall be separately dealt in the E-auction Document for Option I-I.e. Sale of set of assets collectively.  
 3. This Sale Notice is in accordance with the Insolvency and Bankruptcy Code, 2016, and in line with the directions given in the order dated 01/03/2023 of Hon'ble Delhi High Court. Please read the order dated 01/03/2023, the e-auction document, Information Memorandum and all other documents uploaded in the Data Room/DIR created for this auction.  
 4. The details of assets forming part of Block A having any pending legal cases/on-going litigations/ Disclosures have been disclosed in the Information Memorandum document and are to be mandatorily seen before participating in this auction.  
 5. The sale of the units under Block A does not include any GST Input Credit lying in the GST Registrations/Portal of PSL Limited (GSTIN No. for all units will be mentioned), and does not include any receivable, security deposits lying in any government department or board or any other private/public entity.  
 6. The Applicability of taxes including stamp duty on Land & Building shall be governed by the prevalent laws of India or respective State and plant and machinery, stock, inventory & consumables of respective plant shall be sold after levying applicable GST.  
 7. The Liquidator in consultation with the Stakeholder of PSL Limited holds rights to cancel the auction for H1 bidder for the respective Block of asset and select the H2 bidder. If it is found that the H1 bidder is ineligible under 29A verification. Hence, post the auction the name of Successful bidder will not be announced till 29A verification is not completed for the winners of respective blocks.  
 For detailed terms and conditions kindly refer to the website of AAA Insolvency Professionals LLP i.e. https://insolvencyandbankruptcy.in/public-announcement(PSL-Limited) and the E-Auction Process Document uploaded on the aforementioned link, prior to submission of EMD and participation in the process.  
 Nitin Jain  
 Date : 09.11.2023  
 Place : New Delhi  
 Liquidator in the matter PSL Limited  
 IBBJ (Regn. No. IBBJ/IPA-001/IP-P-01562/2019-2020/12462)  
 Corp. Office Address: E-10A, Kalash Colony, G.K.-1, New Delhi - 110048  
 Liquidator Address: E-337, Ground Floor, G.K.-1, New Delhi - 110048  
 Email: assetsale1@aaainsolvency.in, assetsale2@aaainsolvency.in, nitinjain@aaainsolvency.com  
 Contact Person: Mr. Puneet Sachdeva, Mr. Wasim & Mr. Rajkumar - 8800865284

## POSSESSION NOTICE (for immovable property)

**Whereas,**  
 The undersigned being the Authorized Officer of **INDIABULLS HOUSING FINANCE LIMITED (CIN:L65922DL2005PLC136029)** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice dated 09.01.2020 calling upon the Borrower(s) **RAJESHBHAI DAYABHAI KANAKD ALIAS KANKAD RAJESH DAYABHAI PROPRIETOR 'TIRTH CREATION' AND JAYSHRIBEN RAJESHBHAI KANKAD ALIAS KANKAD JAYSHRIBEN RAJESHBHAI** to repay the amount mentioned in the Notice being Rs. 21,29,134.30 (Rupees Twenty One Lakhs Twenty Nine Thousand One Hundred Thirty Four and Paise Thirty Only) against Loan Account No. HLASUR00278600 as on 08.01.2020 and interest thereon within 60 days from the date of receipt of the said Notice.  
 The Borrower(s) having failed to repay the amount, Notice is hereby given to the Borrower(s) and the public in general that the undersigned has taken **Possession** of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on 05.11.2023.  
 The Borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **INDIABULLS HOUSING FINANCE LIMITED** for an amount of Rs. 21,29,134.30 (Rupees Twenty One Lakhs Twenty Nine Thousand One Hundred Thirty Four and Paise Thirty Only) as on 08.01.2020 and interest thereon.  
 The Borrowers' attention is invited to provisions of Sub-Section (8) of Section 13 of the Act in respect of time available, to redeem the Secured Assets.

## DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

PROPERTY SITUATED AT DISTRICT SURAT, SUB DISTRICT TALUKA PUNA (SURAT CITY) OF MOUJE GAM PUNA, BLOCK No. 346/A, FOR COMMERCIAL PURPOSE OVER THE NON AGRICULTURAL LAND ADMEASURING 8397 SQ.MTS. OF LAND OF T.P. SCHEME No. 80 (PUNA) OF FINAL PLOT No. 116 OF LAND ADMEASURING 6718 SQ.MTS. ON THAT NON-AGRICULTURAL LAND FOR COMMERCIAL PURPOSE SCHEME DEVELOPED AND KNOWN AS 'THE PALLADIUM MALL' OF COMMERCIAL BUILDING IN THAT SHOP ON GROUND FLOOR FOR COMMERCIAL SHOPS PAKIAI PER PLACE BOOKING SHOP NO. 101 AND AS PER APPROVED PLAN SHOP NO. G-101, OF PROPERTY HAVING BUILTUP AREA OF 19.45 SQ.MTS. AND CARPET AREA OF 18.61 SQ.MTS. AND LAND UNDER THAT SHOP AND PROPORTIONATE UNDIVIDED SHARE OF LAND ADMEASURING 10.28 SQ.MTS. WHICH IS INCLUSIVE OF OTHER RIGHTS OVER THE PROPERTY WHICH IS BOUNDED AS FOLLOWS:  
 EAST : ADJOINING MARGIN AND PROPERTY OF BLOCK NO. 349  
 WEST : ADJOINING MARGIN AND PROPERTY OF BLOCK NO. 379/1  
 NORTH : ADJOINING MARGIN AND PROPERTY OF BLOCK NO. 346/B  
 SOUTH : ADJOINING MARGIN AND PUBLIC ROAD

Date : 05.11.2023  
 Place: SURAT  
 Sd/-  
 Authorised Officer  
 INDIABULLS HOUSING FINANCE LIMITED



## LIC Housing Finance Limited

Ahmedabad Back Office: Shop No. 207-210, Span Trade Center, II Floor, Paldi, Ahmedabad - 380006, Gujarat

## SYMBOLIC POSSESSION NOTICE (For immovable property)

WHEREAS, The undersigned being the Authorized Officer of LIC Housing Finance Ltd. (LICHL) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) of the Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice calling upon the borrower (s) / Guarantors (s) cum mortgagor to repay the amount mentioned in the notice and interest thereon within sixty days from the date of receipt of the said notice.  
 The borrower (s) / Guarantors (s) having failed to repay the amount, notice is hereby given to the borrower (s) and Guarantor and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of powers conferred under Section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002.  
 The borrower(s) and Guarantor attention is invited to provisions of Section 13(8) of the Act, in respect of time available, to redeem the secured assets.  
 The borrower(s) and Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of LIC Housing Finance Ltd. (LICHL) for an amount as mentioned herein + future interest and other charges and interest thereon.

Sr. No.	Name of Borrower/Co-borrower/ Mortgagee/Guarantor & Loan A/c No.	Description of Secured Asset	Demand Notice Date and Amount	Date of Possession
1	Mr. MANISH J PATEL (Borrower) & Mr. KAMLESH J PATEL (Co-Borrower) Loan A/C No. 61270004343161270004344	All That Part and Parcel of The Property Consisting of Plot No. 54, Madhavkunj Society, Opp. Sharda School, Causeway Road, singanpore, Moje, singanpore, Tal. Choryasi, Dist. Surat, Gujarat-395004	22/09/2021 Rs. 56,81,068.10/- + future interest and other charges	03/11/2023
2	Mr. Bhavinbhai C Virani (Borrower) Loan A/c no. 611500006191	All that Part and Parcel of the property consisting of Flat No. 404, Building No. L, Radhika Residency and Point, Varyiyav, Adajan, Surat, Gujarat (R.S. No. 1218, Block No. 1161 of Village: Varyiyav)	21.01.2022 Rs. 37,13,257.15/- + future interest and other charges	03/11/2023
3	Mr. Rameshbhai Laljibhai Bhalaya (Borrower) & Mrs. Ramaben Rameshbhai Bhalaya (Co-Norrower) Loan A/c No. 612700002513 & 612700002838	All that Part and Parcel of the property consisting of Plot No.23, Madhav Park, R.S.No.216/1+2, 219/1, Block No. 208 & 209, T.P.S No. 27, F.P. No. 84 & 85, Utran Gam, Surat, Gujarat- 394105.	06/12/2021 Rs. 85,68,052.95/- + future interest and other charges	03/11/2023
4	Mr. Kamlesh Bhupatbhai Bhanderi (Borrower) & Ms. Reemaben Kamleshkumar Bhanderi (Co-Borrower) Loan A/c No. 612700003411	All that Part and Parcel of the property consisting of Building No. B/1, Flat No. 1103, 11th Floor, Pramukh Aranya, Bih DMD LP Market, Moje. Parvat, Tal. Udhna, Dist. Surat, Surat-395010	06.09.2021 Rs. 80,69,312.53/- + future interest and other charges	03/11/2023
5	Mr. Mrsharshaben Subhashbhai Pithadiya (Borrower) & Mr. Mrssubhashbhai Maganbhai Pithadiya (Co-Borrower) Loan A/c No. 612700005220	All that Part and Parcel of the property consisting of Building No. A-1, Flat No. 404, Krishna Residency, Opp. Seven Star Residency, New Kosad Road, Moje, Kosad, Tal. Surat City (Adajan), Dist. Surat, Surat- 394107.	06.09.2021 Rs. 21,95,359.52/- + future interest and other charges	03/11/2023
6	Mr. Mavjibhai K Chouhan (Borrower) Loan A/c No. 611500005118 and 611500006914	All that Part and Parcel of the property consisting of :- Flat No.27, G/2, Om Township -5, Kamrej, Pasodara, Surat, Gujarat - 395004. (R.S. No. 138/1K, 138/2, 138/1B, 137/3, 136/2 and 136/1), (Block No. 182, 184, 185, 186, 188, and 189 of Pasodara)	06/12/2021 Rs. 23,13,398.63/- + future interest and other charges	03/11/2023
7	Mr. / Mrs. Dinesh Bhagvanbhai Vaghasiya (Borrower) Loan A/C No. 611500005612	All That Part and Parcel of The Property Consisting of :- Flat No. 501, Building No. R, Navkar Residency, Nr. Diamond School, Kathodara Road, Navagam, Surat, Gujarat - 395008. (R.S. No. 54, Block No. 54 of Village : Navagam)	28/01/2022 Rs. 22,82,023.96/- + future interest and other charges	03/11/2023
8	Mr. / Mrs. Meghaben C Upadhayay & Mr. / Mrs. Chandresh Rajeshbhai Upadhayay (Borrower) Loan A/C No. 611500007099	All That Part and Parcel of The Property Consisting of :- Flat No. 502, A/1 Building, Saurashtra Township, Part-1, Pasodara Patiya, Kamrej, Surat, Gujarat- 395008	20/12/2021 Rs. 35,45,338.19/- + future interest and other charges	03/11/2023
9	Mr/Mrs Truptiben Sojitra (Borrower), Mr / Mrs. Dharmendrabhai B Sojitra (Co-Borrower) & Mr / Mrs Rajeshbhai B Sojitra (Co-Borrower) Loan A/C No. 611500009102	All that Part and Parcel of the property consisting of at Flat No. 404, Building No. A, Alpine Green Valley, Nr Navi Valak Masjid, Valak, Kamrej, Surat, Gujarat (R.S. No. 112,116 To 118, Block No. 106/A of Village:valak)	28/01/2022 Rs. 33,62,625.81/- + future interest and other charges	03/11/2023
10	Mr / Mrs Bhaveshbhai S Patel (Borrower) & Mr / Mrs Devangiben Bhaveshbhai Patel (Co-Borrower) Loan A/c No. 611500003365	All that Part and Parcel of the property consisting of Plot No.47, Sanskrit Row House Society, Kosad, Surat, Gujarat- 395007. (R.S. Block No. 1075 & 1077, Sub Plot No. 1)	20/12/2021 Rs. 53,11,104.81/- + future interest and other charges	03/11/2023
11	Mr / Mrs. Sunilkumar Balvantbhai Patel & Mr / Mrs. Monaben Sunilbhai Patel (Borrower) Loan A/c No.611500004268	All that Part and Parcel of the property consisting of :- Flat No. 601, Building No. A, 6th Floor, Parishm Park, Near Ashish Row House, Opp. Shashwat Row House, Jahangirpura, Surat, Gujarat- 395006.	27/12/2021 Rs. 55,15,487.95/- + future interest and other charges	03/11/2023
12	Mr / Mrs Mayur Gabharubhai Radadiya, Mr / Mrs Vasantben G Radadiya & Mr. / Mrs. Gabhrubhai B Radadiya (Borrower) Loan A/c No. 611500007132	All that Part and Parcel of the property consisting of :- Flat No. 201, Building No. C, Santosa Heights, Nr.salgiram Heights, Utaran, Surat, Gujarat-395006.	16/02/2022 Rs. 40,91,390.79/- + future interest and other charges	03/11/2023
13	Mr Paresb Keshubhai Bheda (Borrower) Loan A/c No. 611500007163	All that Part and Parcel of the property consisting of :- Flat No. 504, Building No. H, Manya Residency, VII : Simada, Tal. Surat City, Dist. Surat, Gujarat - 395006.	19/09/2022 Rs. 26,57,688.87/- + future interest and other charges	03/11/2023
14	Mr. Himanshu Shitaram Sharma & Mr / Mrs. Ilaben Sharma Sharma (Borrower) Loan A/c No.611500007609	All that Part and Parcel of the property consisting of :- Flat No. E-303, Green Aerasto Residency, (R.S. No. 61, Block No. 59, TPS No. 30 Moje Vanakla, F.P.No. 42) Vanakla, Surat, Gujarat- 395005	20/12/2021 Rs. 34,37,101.98/- + future interest and other charges	03/11/2023

Sr. No.	Name of Borrower/Co-borrower/ Mortgagee/Guarantor & Loan A/c No.	Description of Secured Asset	Demand Notice Date and Amount	Date of Possession
15	Mr. / Mrs. Bakulkumar Aich & Mr. / Mrs. Sandhyaben Bakulbhai Aich Borrower Loan A/c No. 611500007839	All that Part and Parcel of the property consisting of :- Tenament No. 191, 1465 LIG GBH, Jalarang Nagar, Nr. R u s h i k e s h R e s i . , M o j e , Chhaprabhatha, Dist. Surat, Gujarat-394107	17/05/2022 Rs. 27,54,522.76/- + future interest and other charges	03/11/2023
16	Mr/mrs Kalpeshbhai Vallabbhai Lukhi (Borrower) & Mr / Mrs Kailashben Kalpeshbhai Lukhi (Co-Borrower) Loan A/c No. 611500009770	All that Part and Parcel of the property consisting of Flat No. D-1203, The Bluebell, Opp-Bhawani Heights, Near Aakruti Heights, Mota Varachha, Surat -394101.	12/11/2021 Rs. 34,90,659.74/- + future interest and other charges	03/11/2023
17	Mr / Mrs Varshaben Bharatbhai Khokhariya (Borrower) & Mr / Mrs Bharatbhai P Khokhariya (Co-Borrower) Loan A/c No.612700002086	All that Part and Parcel of the property consisting of Flat No. C 1103 Sawastik Tower, Final Plot No 59, Tps 21, Block No 143 144/B, R S No 146 147, Sarthana Punagam, Dist. Surat	22/12/2022 Rs. 68,95,939.50/- + future interest and other charges	03/11/2023
18	Mr Lalit Dhanjibhai Goyani & Mr Dhanjibhai Tulashibhai Goyani (Borrowers) Mr Rameshkumar Bhagvanbhai Savani (Guarantor) Loan A/c No. 611500004455	All that Part and Parcel of the property consisting of Flat No. 201, Building No. C/1 (As Per Sanctioned Plan -1st Floor & As Per Place 2nd Floor), Star Dharm Residency, Pasodara Char Rasta, Village, Navagam, Tal. Kamrej, Dist. Surat-394185.	12/09/2022 Rs. 27,48,862.63/- + future interest and other charges	4/11/2023
19	Mr. Mayurbhai Devshibhai Parkhiya & Mr. Devshibhai Laxmanbhai Parkhiya (Borrowers) Mr Jayesh D. Parkhiya (Guarantor) under Loan A/c No. 611500004504	All That Part and Parcel of The Property Consisting of Flat No. 402, 4th Floor, Building No. B-1, *Star Dharm Residency*, Revenue		

# રાંદેર રોડ પર ફારે ટક્કર મારતા મોપેડ સવાર પતિ-પત્ની ઘાયલ

## ગંભીર અકસ્માત સર્જી કરચાલક ફરાર

(પ્રતાપ પ્રતિનિધિ) સુરત, તા ૧૦ રાંદેર ઝુપલ ચાર રસ્તા મહાવીર પેટ્રોલ પમ્પ સામે બુધવારની રાત્રિએ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. એકિટવા પર સવાર દંપતીને પાછળથી પૂરડાપે આવી રહેલા ફોરવર્ડીલ કરના ચાલકને ઉડાવતા પતિ પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. રાંદેર ઝુપલ ચાર રસ્તા દિવાળીબાગ સોસાયટી ગેટ નંબર ૨ પાસે રહેતાં દર્શક કોશિક

બકરીવાળા પત્ની સાથે મોપેડ ઉપર સવાર થઈ નીકળ્યા હતા. તેઓ ઝુપલ ચાર રસ્તા મહાવીર પેટ્રોલ પમ્પ સામેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી ફૂલ સ્પીડે અને ગલફતમરી રીતે આવેલા આઈ ટવેન્ટી ફોર વહીલ કરના ચાલક (જી જે.પી.એ.એલ.૪૮૮૩)એ પાછળથી તેમની મોપેડને ટક્કર મારી હતી. જેમાં દર્શક ભાઈ અનર પત્ની ઉર્વાભિનેને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત દંપતીને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે કરચાલક અકસ્માત સરજી ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ અંગે રાંદેર પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.

# રાતબની ધાર્મિક વિધિમાં એક યુવકને તલવાર વાગતા ગંભીર ઈજાઓ

## યુવકને હોસ્પિટલમાં દાખલ કરાયો

(પ્રતાપ પ્રતિનિધિ) સુરત, તા ૧૦ નવસારીના ગણદેવી તાલુકાના સરિભુજરંગ ગામમાં ધાર્મિક વિધિ દરમિયાન એક યુવકને પેટમાં તલવાર લાગી જતા મોટો ઘા થઈ જતા આંતરડા બહાર આવી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા યુવકને ખાનગી હોસ્પિ. માં દાખલ કરાયો છે. મુસ્લિમ સમાજના કેટલાક લોકો દ્વારા નવસારીના ગણદેવી

તાલુકાના સરિભુજરંગ ગામમાં એક જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મુસ્લિમ સમાજના લોકો રાતબ(પોતાના શરીરે તલવાર મારવી સહિતની કરતબો) ખેલી રહ્યા હતાં. તે દરમિયાન એક યુવક તલવારથી શાબિર મેમખા ઉપર તલવાર લગાવી રહ્યા હતા. તે વખતે તલવારનો ઘા ઉઠેર ઉતરી ગયો હતો. જેમાં સાબિર મેમખાને ગંભીર ઈજા પહોંચી હતી. તલવાર લાગવાથી સાબિર મેમખાના આંતરડા બહાર આવી ગયા હતા. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના કેટલાક લોકો રાતબ રમે છે.



દેવાવલી પર્વમાં ધનતેરસનું આગવું મહત્વ હોય છે. આ દિવસે હિન્દુઓ ભગવાન લક્ષ્મીદેવીની પૂજા-અર્ચના કરે છે. સુરતની મહિલા વકીલીએ એવોકેટ શ્રીમતી પ્રીતિબેન ખેશ્નીની સહાયતામાં તહેવાર નિમિત્તે ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત રીતે લક્ષ્મીદેવી માતાની રંગોળી બનાવીને દીપ પ્રજ્વલન કરી ધનતેરસની ઉજવણી કરી હતી.

### બિહારમાં પહેલા પાનનું ચાલુ

ગયા અને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું. આ પછી ઘણા દાગી ગયેલા લોકોને બેઠિયા, રક્ષકો અને મોતિહારીની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આગને કાબુમાં લેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોમાંથી આઠની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

### મુંબઈ ટોલનાકા પહેલા પાનનું ચાલુ

ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ડીસીપી કૃષ્ણકાંત ઉપાધ્યાયે જણાવ્યું કે, ટ્રાફિક પોલીસ સી લિંક કરના વાહનોને હટાવ્યા હતા. આ મામલામાં એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.

### ધન તેરસ પહેલા પાનનું ચાલુ

છે. આ વર્ષે દિવાળી ૧૨ નવેમ્બરે ઉજવવામાં આવશે. ધનતેરસ હિંદુ મહિના કારતકના કૃષ્ણ પક્ષના તેરમા ચંદ્ર દિવસે ઉજવવામાં આવે છે.

### ભારતનો પહેલા પાનનું ચાલુ

માટે જાણીતો હતો. આતંકવાદીઓના કાળ બન્યા અજ્ઞાત હુમલાખોરો: હાલના દિવસોમાં એટલે કે એક સપ્તાહમાં લશ્કરના કોઈ આતંકી અને ભારતના હુમલ નંબર વન એવા આતંકીની ભીજી હતા છે. ગાઝાની હત્યા વોન્ટેડ આતંકવાદી અને કમાન્ડો ફોર્સ (કેસીએફ)ના પ્રમુખ પરમજીત પંજવારના મોતની યાદ અપાવે છે. પંજવારની મે મહિનામાં અજ્ઞાત લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. આજ રીતે લશ્કર એ તેયબાના આતંકી મોલાના રહેવાસની કરામીના ગુલિસ્તાન એ જોહરમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ ઉપરાંત લશ્કરના જ આતંકી મુકતી કેજર ફારુકની ગુલશન એ ઉમર મદરેસામાં ગોળી મારી હત્યા કરાઈ હતી. આ ઉપરાંત જેશ એ મોહમ્મદના આતંકી શાહીદ લતીફ કાર કરાયો હતો. તે પટાણકોટ એરબેઝમાં ૨૦૧૬માં હુમલાનો માસ્દર મારીન હતો.

### ગાગા પર પહેલા પાનનું ચાલુ

દબાણ અપાયું છે અને મર્યાદિત સમય માટે યુદ્ધ વિરામ સહિતના ઉપાયો પર સહમત થવા જણાવ્યું છે તે સમય નેતાન ધાહુના આ વિધાનો મહત્વના છે.

### અમેરિકા ઈચ્છે છે કે, ગાગાપટ્ટીમાં પેલેસ્ટાઈન

ઓથોરીટીની સરકાર બનાવી જોઈએ પણ પેલેસ્ટાઈન ઓથોરીટીના મહમુદ અબ્બાસે સ્પષ્ટ કહ્યું છે કે ઈઝરાયેલ સેન્સ જ્યાં સુધી ગાગામાં છે. અમારી સરકાર બનાવવાનો કોઈ પ્રશ્ન જ નથી.

### એકાએક પહેલા પાનનું ચાલુ

સ્થિતિથી અન્યાનક જ મુત્યુ, દક્ષિણ એશિયન લોકોમાં આ સંબંધી શારીરિક સ્થિતિ નિયમીત આરોગ્ય વેકઅપની જરૂરિયાત, લક્ષણો પારખવા, કોવિડ બાદની શારીરિક વિષમતાઓ કોવિડ વેકસીનની અસર બિન આરોગ્યપ્રદ ખોરાકની સ્વાસ્થ્ય પર અસર બંધાણ, જીમ કરીને કસરતમાં સંયમ તથા ખાસ કરીને ઓર્થોપેડિક જ હૃદયરોગ હુમલાની સી.આર.પી. માટે ખાસ કરીને મુશ્કાફરોને તાલીમ આ તમામ વિષયોને આવરી લેવાયા હતા.

જે સમીર દાણીએ કહ્યું કે, તંબાકુના વેચાણનો પ્રશ્ન આવે તો તેનાથી કેન્સર થાય છે તેવી ધારણા બાંધી લેવાય છે પણ વિશ્વભરમાં એ પણ જોવા મળ્યું કે, તંબાકુના વ્યસનથી પણ હૃદયરોગ થાય છે અને મૃત્યુ થાય છે તેથી તંબાકુના

### કારણે હૃદયના રોગો અંગે પણ જાગૃતિ જરૂરી છે.

ઉપરાંત ઘવાના ખૂબજ હાઈડોજ પછ લોકોને મારી રહ્યા છે. જો કે તેઓએ સ્વીકાર્યું કે જેઓને કોવિડની તિવ્ર અસર થઈ હોય તેને કાર્ડિયોએરેસ્ટની શક્યતાનો સંબંધ પ્રસ્થાપિત થયા છે. જો કે નિષ્ણાંતો કોવિડ વેકસીન અને હૃદય સંબંધી સમસ્યા અંગે કહ્યું કે આ માટે કોઈ ચોક્કસ પુરાવા નથી. નિષ્ણાંતોએ યુવાઓને ખાસ જીવનમાં આકરી કવાયતના માર્ગે જતા પુર્વે તબીબની સલાહ લેવાની ભલામણ કરી હતી. પ્રોટીન પાવડાના ઉપયોગ સામે પણ સાવચેતીનો સૂર કાઢ્યો હતો. તેઓએ કહ્યું કે પશ્ચિમી જગત કરતા ભારતમાં લોકોને હૃદય સંબંધી રોગો થવાની શક્યતા વધુ હોય છે.

### બ્રાઝિલની પહેલા પાનનું ચાલુ

ન હતી. યુવાનાના મૃત્યુના સમાચાર બાદ તેના ચાહકો ખૂબ જ દુ:ખી છે. તેમના નિધન પર ચાહકો અને ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. આ સિવાય તેના બોયફ્રેન્ડ અને ટીવી એક્ટર જોઆઓ હદાદે પણ દુ:ખ વ્યક્ત કરતી પોસ્ટ લખી છે. તેણે લખ્યું, 'હું ભોગી ગયો છું અને મારું સૌથી દુ:સ્વપ્નમાં જીવી રહ્યો છું. મારો એક હિસ્સો જતો રહ્યો. ખૂબજ અફસોસ અને ભારે પીડા સાથે છે કે હું મારી હુઆના, મારી રાજકુમારીને વિદાય આપ્યું છું.

### વેસ્ટ બેંક પહેલા પાનનું ચાલુ

શરણાર્થી શિબિરમાં નોંધાયેલા છે, જે જેનિન મ્યુનિસિપાલિટીની સરહદે છે અને પશ્ચિમ બેંકમાં સૌથી ઉત્તરીય શિબિર છે. ઓક્ટોબરે હુસ્તે ઈઝરાયેલ સામે યુદ્ધ શરૂ કર્યું ત્યારથી, પશ્ચિમ કાંઠે ઈઝરાયેલી દળો દ્વારા ૪૫ બાળકો સહિત ૧૬૭ વેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.

### નીલિયા કુમારે પહેલા પાનનું ચાલુ

નિતાશકુમાર દ્વારા આ શબ્દો કહેવાતા હતા ત્યારે તેમના જ પક્ષના મહિલા વિધાયકો અને શ્રીમતી રાખત્રી દેવીએ શરમથી માથું ઝુકાવી દીધું હતું, જે બતાવે છે કેટલી હલકી કક્ષાની વાત કરવામાં આવી રહી હતી. આ માટે દેશભરની મહિલાઓ ક્યારે પણ નિતાશકુમારને માફ નહીં કરે. સુરત શહેરના મેયર દ્વારા પણ આની ધોર નિંદા કરી તેને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી.

### અગાઉકો પહેલા પાનનું ચાલુ

અગાઉકો એક ઈન્ટરનેશનલ પ્રોક્વોરમેન્ટ અને ફૂલફીલમેન્ટની સંસ્થા છે. આ એમઓયુ સાર્ઠન થવાના કારણે અનેક વેપારી મિત્રોને આંતરરાષ્ટ્રીય બજારની માંગને પૂર્ણ કરવા માટે સરળ માધ્યમથી તક મળશે. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના મિશન-ટઝના કન્વીનર સંજય પંજ્રબી અને મિશન-ટઝના સીઈઓ પરેશ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

### શહેરની ટેકસટાઈલ પહેલા પાનનું ચાલુ

કતારગામ ઝોનમાં નંદી કિનારે રોડ થી હાથી મંદિર રોડની આસપાસના વિસ્તારમાં માં ૮૦ કર્મચારીઓ દ્વારા સફાઈ કામગીરી લાઇ કરવામાં આવેલ હતી. ઉપના નો નમુનો લેવામાં આવેલ હતો જે કનકમ જાહેર થયેલ હતો. (૫) તા. ૨૮/૦૨/૨૦૨૦ ના રોજ મિન્ટ્રી નો નમુનો લેવામાં આવેલ હતો જે કનકમ જાહેર થયેલ હતો, (૬) તા. ૨૧/૦૬/૨૦૨૧ ના રોજ Shubb Cow Ghee (From 15 Kg Co.Pack Tin) નો નમુનો લેવામાં આવેલ હતો જે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ હતો. સદર સબસ્ટાન્ડર્ડ નમુના અન્વયે મહે. એજ્યુકેટીવ

### વધુ કર્મચારીઓએ સાફ-સફાઈ કરી હતી.

અઠવા ઝોનમાં સિટીલાઈટ શક માઈટ અને તેની આસપાસનો વિસ્તારમાં ૧૧૭ થી વધારે સફાઈ કર્મચારી દ્વારા સફાઈ રૂબેશની કામગીરી ને સફળ બનાવવાના પ્રયાસ કર્યો.

તેમજ ઈજનેર વિભાગ દ્વારા જરૂરી પેચવર્કની કામગીરી, ફૂટપાથ રીપેર કરવામાં આવેલા હતા, આરોગ્ય વિભાગ ના અધિકારીઓ દ્વારા આસપાસ ના વિસ્તારોમાં સર્વે કરી ગંદકી જણાયેલા સ્થળ પર નોટિસ આપી ને ડંડની કાર્યવાહી પણ કરી હતી. આ સાથે અન્ય કામગીરી માં દરેક દુકાનો માં કચરાપેટી રાખવા માટે અનુરોધ કરવા માં આવ્યો તેમજ કચરા ના વર્ગીકરણ માટે સમજ આપી, કચરો નહી નાખવા માટે ના સ્ટીકર લાગવવા માં આવ્યા.

આ તમામ સ્થળ પર કરવામાં આવેલ સફાઈ ઝુંબેશ દરમ્યાન કુલ ૧૮ કિલો પ્લાસ્ટિક તથા ૩૪ મેટ્રિક ટન અન્ય કચરો એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ તથા પ્રોસેસિંગ કરવામાં આવેલ હતો. વધુમાં ટેકનિકલ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ૫૫ મશીન હોલ, ૨૫૯ મીટર ફૂટપાથ રિપેરિંગ, તથા ૧૧ સ્થળો ઉપર પેચવર્કની કામગીરી કરવામાં આવેલ છે તમામ ઝોન ખાતે સી એન્ડ ડી વેસ્ટ નિકાલની પ્રાઈવ કરી કુલ ૧૧૨ મેટ્રિક ટન સી એન્ડ ડી વેસ્ટ પ્રોસેસિંગ માટે મોકલવામાં આવેલ છે.

### બારડોલી પહેલા પાનનું ચાલુ

આયું છે. આ ઉપરાંત સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા જનભાગીદારી થકી ડેર ડેર સ્વચ્છતાથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થઈ રહ્યું છે. જેના પરિણામે સફાઈ ઝુંબેશ જન આંદોલનમાં પરિણમ્યું છે. કામરેજની પહેલા પાનનું ચાલુ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દરેક જગ્યાએ સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ થકી સુરતને સ્વચ્છ અને સુંદર બનાવાઈ રહ્યું છે.

### ભાંડોના પહેલા પાનનું ચાલુ

સંગીતાબેન પાટીલ, માન. ધારાસભ્ય શ્રી સંદિપભાઈ દેસાઈ, માન. ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, માન. ડે. મેયર ડી. નરેન્દ્રભાઈ પાટીલ, માન. સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજન પટેલ, માન. કમિશનર શ્રીમતી શાશિની અગ્રવાલ, માન. શાસકપક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, માન. ડંડક શ્રી ધર્મેશ વાણિયાવાળા, પૂર્વ માન. ધારાસભ્ય શ્રી વિવેક પટેલ, માન. વિવિધ સમિતિ અધ્યક્ષશ્રીઓ, મ્યુ. સદસ્યશ્રીઓ, પત્રકાર મિત્રો તથા જાહેર જનતા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

### વિર મિલ્ક પહેલા પાનનું ચાલુ

થયેલ હતો, (૪) તા. ૨૮/૦૨/૨૦૨૦ ના રોજ Oriya Cow Ghee (200 ml Co.Pack) નો નમુનો લેવામાં આવેલ હતો જે કનકમ જાહેર થયેલ હતો. (૫) તા. ૨૮/૦૨/૨૦૨૦ ના રોજ મિન્ટ્રી નો નમુનો લેવામાં આવેલ હતો જે કનકમ જાહેર થયેલ હતો, (૬) તા. ૨૧/૦૬/૨૦૨૧ ના રોજ Shubb Cow Ghee (From 15 Kg Co.Pack Tin) નો નમુનો લેવામાં આવેલ હતો જે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ હતો. સદર સબસ્ટાન્ડર્ડ નમુના અન્વયે મહે. એજ્યુકેટીવ

### ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી, સુરત સમક્ષ એડ્યુકેટીવ કેસ દાખલ કરવામાં આવેલ હતો.

સદર કેસમાં મહે. એજ્યુકેટીવ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી, સુરત ધવારા શ્રી ભુષેષ ઈશ્વરભાઈ ભરતીયા, ( ન નમુનો આપનાર એફ.બી.ઓ) ને રૂ. ૭૫,૦૦૦/- અને શ્રી અશોકકુમાર કાલીદાસ ભરતીયા, ( તે ઉપવાદક પેઢીના માલિક) ને રૂ. ૧,૨૭,૦૦૦/-નો દંડ કરવામાં આવેલ છે. (કુલ દંડ રૂપિયા ૨,૦૨,૦૦૦/-) તથા નમુનો લીધા બાદ બાકી રહેલ જીન્ડા ૪૭૯.૨૮ રૂ. આ જથ્થો સીની કિંમત રૂ. ૨,૧૭,૦૭૭/- પર્ચાવરણને નુકશાન ન થાય તે રીતે નિકાલ કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

### સુરત મહાનગર પહેલા પાનનું ચાલુ

કિનારે રોડ થી હાથી મંદિર રોડની આસપાસના વિસ્તારમાં માં ૮૦ કર્મચારીઓ દ્વારા સફાઈ કામગીરી લાઇ કરવામાં આવેલ હતી. ઉપના ઝોન-એ પીયુ પોઈન્ટ અને બ્રિજ અને તેની આજુ બાજુના વિસ્તારમાં ૭૮ થી વધુ કર્મચારીઓ એ સાફ-સફાઈ કરી હતી. ઉપના ઝોન-બી ગજરા સ્કુલ, સરદારનગર સોસાયટી થી નાહેર પાલી વિસ્તારમાં ૫૬ થી વધારે કર્મચારીઓ દ્વારા સફાઈ કામગીરી લાઇ કરવામાં આવેલ હતી. લીબાયત ઝોનમાં ભાંડેના બ્રિજ રોડ તેની બાજુના વિસ્તારમાં ૧૩૬ થી વધુ કર્મચારીઓ એ સાફ-સફાઈ કરી હતી. અઠવા ઝોનમાં સિટીલાઈટ શક માઈટ અને તેની આજુ બાજુના વિસ્તારમાં ૭૫ થી વધુ કર્મચારીઓ દ્વારા સફાઈ રૂબેશની કામગીરી ને સફળ બનાવવાના પ્રયાસ કર્યો. તેમજ ઈજનેર વિભાગ દ્વારા જરૂરી પેચવર્કની કામગીરી, ફૂટપાથ રીપેર કરવામાં આવેલા હતા, આરોગ્ય વિભાગ ના અધિકારીઓ દ્વારા આસપાસ ના વિસ્તારોમાં સર્વે કરી ગંદકી જણાયેલા સ્થળ પર નોટિસ આપી ને ડંડની કાર્યવાહી પણ કરી હતી. આ સાથે અન્ય કામગીરી માં દરેક દુકાનો માં કચરાપેટી રાખવા માટે અનુરોધ કરવા માં આવ્યો તેમજ કચરા ના વર્ગીકરણ માટે સમજ આપી, કચરો નહી નાખવા માટે ના સ્ટીકર લાગવવા માં આવ્યા.

### સુરત મહાનગર પહેલા પાનનું ચાલુ

કરવામાં આવવા છે. જે અંતર્ગત આજ રોજ તા.૦૮/૧૧/૨૦૨૩ ના રોજ વેસુ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી ટિપ પ્રાગટ્ય કરી સાતમા વિના-મુલ્યે આરોગ્ય નિદાન/સારવાર કેમ્પનો શરૂઆત કરવામાં આવ્યો, આ પ્રસંગમાં સુરત મહાનગરપાલિકાના પાણી સમિતિના અધ્યક્ષશ્રી હિમાંશુ પ્રિયારામ સિંહ રાઉલજી, ઝુપલાલયો, વૈદકીયરાહત અને તંદુરસ્તીવર્ધક સમિતિના નાયબ અધ્યક્ષશ્રી કેલાશબેન જોતેશભાઈ સોલંકી, આરોગ્ય સમિતિના નાયબ અધ્યક્ષશ્રી દિપેશ ચંદુભાઈ પટેલ, ગુજરાત રાજ્યના પૂર્વ અધિક નિયામકશ્રી (આરોગ્ય અને પરિવાર કલ્યાણ) ડો.વિકાસબેન દેસાઈ, આરોગ્ય અધિકારીશ્રી ડો.પ્રદીપ ઉમરીગર, ઈજકર્ટશ્રી ડો.સી.બી.પટેલ, મેડિકલ ઓફિસરશ્રી વર્ગ-૧ (કુ.ક.બ્યુરો) ડો. કેનીલ પટેલ, ઝુપલાલયો, વૈદકીયરાહત અને તંદુરસ્તીવર્ધક સમિતિના સભ્યશ્રી અને અઠવા ઝોન વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, અઠવા ઝોનના

### નાયબ આરોગ્ય અધિકારીશ્રી, તેમજ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રી ડો.પ્રદીપ ઉમરીગરે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં PMJAY કાર્ડ અને ABHA ID નું મહત્વ સમજાવ્યું હતું. ABHA ID ના નિર્માણ દ્વારા કોઈ પણ જગ્યાએ આરોગ્યલક્ષી સેવાનો લાભ લેનાર દર્દીના અગાઉ લીધેલ સારવારના ડીજીટલ રેકોર્ડ્સ થકી આગળની સારવાર લેવા માટે પુખ્ત જ મદદરૂપ થઈ શકે એમ હોય લાભાર્થીઓને ABHA ID બનાવી લેવા અનુરોધ કર્યો હતો. સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ આ PMJAY કાર્ડ દ્વારા સદર ઝોનનામાં જોડાયેલ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૧૦ લાખ સુધીની આરોગ્ય સેવાઓ વિના મુલ્યે મેળવી શકાય છે તેમ જણાવ્યું હતું. મંચસ્થ મહાનુભાવો દ્વારા ૧૦ લાભાર્થીઓને PMJAY કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના ઝુપલાલયો, વૈદકીયરાહત અને તંદુરસ્તીવર્ધક સમિતિના નાયબ અધ્યક્ષશ્રી કેલાશબેન જોતેશભાઈ સોલંકીએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ આ PMJAY કાર્ડમાં કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી અને આયુઆન અને નાગરિકોને આ કાર્ડ બનાવી લેવા જણાવ્યું હતું. તેઓએ NPNCDC કાર્યક્રમ હેઠળ ૩૦ વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓને હાઈપરટેન્શન, ડાયાબીટીસ અને ઓરલ કેન્સર માટે સ્ક્રીનિંગને ગર્ભાશયના મુખનું કેન્સર અને સ્તન કેન્સર માટે સ્ક્રીનિંગનું મહત્વ સમજાવી સદર સેવાનો લાભ લેવા જણાવ્યું હતું. હાલમાં નાની વયના વ્યક્તિઓને હૃદય રોગનું પ્રમાણ વધી ગયું છે તો તેનાથી બચવા પાણીપીણીની બાબતમાં કાળજી લેવા, તંદુરસ્ત જીવન શૈલી અપનાવી યોગા, નિયમિત કસરત અને હેલ્થ ચેક અપ કરાવવા જણાવ્યું હતું. જે માટે આરોગ્યલક્ષી પ્રદર્શનોનો લાભ લઈ સાનની પ્રદ્ધિ કરવા જણાવ્યું હતું. સુરત શહેરના નાગરિકોને સુરત મહાનગરપાલિકાના શહેરી આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મળતી વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લેવા જણાવ્યું હતું.

મેડિકલ ઓફિસરશ્રી વર્ગ-૧ (કુ.ક.બ્યુરો) ડો. કેનીલ પટેલે ઉપસ્થિત તમામનો કાર્યક્રમમાં હાજર હોવા માટે આભાર બોલી સદર કાર્યક્રમનો લાભ લેવા માટે જાહેર જનતાને જણાવ્યું.

### સુરત વિલામાં પહેલા પાનનું ચાલુ

૨૦૨૩ થી તા. ૨૫ જાન્યુઆરી-૨૦૨૪ સુધી એટલે કે અઢી મહિના સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ પરિભ્રમણ કરશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા સુરત જિલ્લાને પાંચ આધુનિક પ્રકારના રથોની ફાળવણી કરવામાં આવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાનશ્રીનો વિડીયો સંદેશ, વિકસિત ભારતના સંકલ્પ લેવડાવવા સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જનસેવાના ઉદ્દેશ સાથે યોજનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો

### પાત્રતા ધરાવતા નાગરિકોને અપાશે. યાત્રા દરમિયાન સુરત જિલ્લાની ૬૮૪ ગ્રામ પંચાયતોમાં મહત્તમ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી આયોજન સાથે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા ઉમરદર્શન પુરૂ પાડવામાં આવશે અને યોજનાકીય લાભો અપાશે. ગામેગામ આ યાત્રાનું સ્વાગત અને લાભાર્થીઓની સફળવાર્તા સહિતના કાર્યક્રમો યોજાશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મ યોજના, કિસાન સન્માન યોજના, કિસાન કેડેટ કાર્ડ, પોષણ અભિયાન, હર ધર જલ-જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનપન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, આટલ પેન્શન યોજના, નેનો ફેટલાઈઝર યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાયિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓ તેમજ આદિજાતિ લાભાર્થીઓ માટેની સિકલ સેલ એનીમિયા એલિમીનેશન મિશન, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કુલમાં નોંધણી, શિષ્યવૃત્તિ યોજનાઓ, વન અધિકાર-વ્યક્તિગત અને સામુદાયિક જમીન, વન વિકાસ કેન્દ્ર સ્વસહાય જૂથોનું આયોજન જેવી યોજનાઓને આવરી લેવામાં આવી છે.

### નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ) પી.સી.પટેલે સુરત જિલ્લામાં વિકસિત ભારત યાત્રાના આયોજન અંગેની રૂપરેખા આપતા જણાવ્યું કે,

સુરત જિલ્લામાં આગામી તા. ૧૫ નવેમ્બરથી આ યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા જિલ્લાની ૬૮૪ ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરશે. આ માટે જિલ્લા કક્ષા અને તાલ